

પગલું - ૧૫

ઉમા, આજે રજા છે.

તુ અમારે બગીચે ફરવા ચાલ.

ભગીરથ, તુ પણ આવ.

બગીચામાં જામફળના ઝાડ છે.

ઉમેદ, જામફળ ઉતાર.

ભગીરથ, પાથરણું પાથર.

આપણે બેસીને જામફળ ખાઈએ.

જામફળ ખાઈને રાજી થઈએ.

રાજી થઈને ઘેર જઈએ.

ફળ	હાથ	બરફ
થડ	સાથ	ઘડલી
ઈદ	વાત	ફકીર
ફરસાણ	ઉપાડ	ઉતરાણ

ઉમા	ઉદર	ઉકરડા
ઘઉં	ઉછાળ	ઉઝરડા
ઉમર	ઉઘાડ	ઉધાર
ગુફા	બરફ	ફુંદરડી
ફાંસ	ફણસ	ફીણ
ફુઆ	ફેણ	ફરે
હાથી	રથ	કાથી
થાળી	થડ	સાથી
અથાણું	થનથન	દશરથ
ઇંડું	બાઇ	ઇજા
ઇંટ	રાઇ	ગઇ
બતક નું ઇંડું	કેરી નું અથાણું	
પીતળ ની થાળી	કાગળ ની ફરકડી	
ઝાડ નું થડ	લાકડા નું ઘર	

- થાક લાગે, બેસી જા.
- તરસ લાગે, પાણી પી.
- ઉધરસ આવે, દવા લે.
- સવારે નમન કર.
- રાતે ભજન કર.
- એક નાનું પંખી હતું.
- પાણીમાં મોટો મગર હતો.